

પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૫/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય:-

(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં.૪૩/૨૦૨૧ તા.૨૬/૧૦/૨૦૨૧ અન્વયે ગુમ થનાર ભારતીબેન વા/ઓ ભરતભાઇ ગોહેલ ઉ.વ.૫૫ રહે.જાગૃતિ સોસાયટી રાંદલ કૃપા પોરબંદર તા.૨૯/૧૦/૨૦૨૧ ના રોજ કમલાબાગ પો.સ્ટે. પો.સ.ઇ.શ્રી એન.જે.રાવલ તથા પો.સ્ટાફના માણસોએ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૪:- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ટ કામગીરી/સ્ટ્રેટજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય :-

(૧) કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૧૨૧૮૦૦૬૨૧૦૯૦૬/૨૦૨૧ IPC ક.૩૭૯ મુજબ ફરીયાદી હેમંતભાઇ બાલચંદભાઇ ભાવનાણી ઉ.વ.૫૪ જાતે સીંધી ધંધો વેપાર રહે.પ્રાગા બાપાના આશ્રમ પાછળ લક્ષ્મીનગર દરજી જ્ઞાતીની વંડી પાસે "સુખધામ" પોરબંદરના કબ્જા હવાલા વાળુ સુઝુકી કંપનીનું સફેદ કલરનું ACCESS મોપેડ મોટર સાયકલ મોડેલ ૨૦૧૬નું જેની કિ.રૂ.૧૫,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ. જે અંગે પો.સબ.ઇન્સ.શ્રી એમ.એલ.પરમાર, HC એમ.કે.માવદીયા, HC બી.પી.કારેણા, PC અરવિંદ કાનાભાઇ, PC લખમણ મેરૂભાઇ PC ભરત નાથાભાઇ, PC ભીમાભાઇ દેવાભાઇ સ્ટાફના માણસો કીર્તિમંદિર પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ સબબ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા રાણીબાગ ચારરસ્તા લક્ષ્મી નાસ્તાગૃહ સામે રોડ ઉપર આવતા સુદામાચોકના પાર્કિંગ સ્થળ પર પહોંચતા મો.સા સાથે ચાલક વસંત કાનજીભાઇ સોનેરી રહે. કે.કે.નગર, કૌશલ પાન પાસે બોખીરા પોરબંદરનો હોવાનું જણાવેલ. આ વાહન અંગે કોઇ આધાર પુરાવા રજૂ કરી શકેલ નહીં અને વાહન અંગે સંતોષકારક જવાબ આપેલ નહીં અને વાહન અંગે મજકુરની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત મો.સા પોતે મેમણવાડા નુરી મોગલાઇ પાસેથી ચોરી કરેલાની કબુલાત આપેલ જેથી ચોરાયેલ મો.સા સાથે આરોપીને હસ્તગત કરવામાં આવેલ તેમજ ધોરણસરની કાર્યવાહી માટે ત.ક.અ શ્રી તરફ મોકલી આપવામાં આવેલ છે. આમ ચોર ઇસમને ગણતરીની કલાકોમાં પકડી સદર ચોરીનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવામાં સફળતા મેળવી તેના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મુદ્દા નંબર ૫:- વૃદ્ધો મહિલાઓ કે બાળકોની સુરક્ષા માટેની વિશિષ્ટ કામગીરી:-

(૧) હાર્બર મરીન પો.સ્ટે. :- જાવર વિસ્તારમાં આવેલ સી કુડ કંપનીમાં કામ કરતી મહિલાઓ કામ કરી પરત થતી હોય ત્યારે મેનેજર સમથે મુલાકાત કરી મહિલાઓને ઘરે સુરક્ષિત પહોંચાડવા અંગે સુચના કરેલ તેમજ સીનીયર સીટીઝનની મુકાલાત લીધેલ છે.

મુદ્દા નંબર ૬:- અન્ય લોકહીતની બાબતો જે લોકોને તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) તા.૨૫/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી કમલાબાગ પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ ૭૦ માસ્કનું વિતરણ કરવામાં આવેલ. લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનું પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

(૨) તા.૨૫/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી હાર્બર મરીન પો.સ્ટે. ના અધિકારી/કર્મચારીઓ દ્વારા પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગ દરમ્યાન કોવીડ-૧૯ ના સંક્રમણને ધ્યાને લઈ ૪૫ માસ્કનુ વિતરણ કરવામાં આવેલ. લોકોને કોવીડ-૧૯ બાબતે સરકારશ્રીએ બહાર પાડેલ ગાઈડ લાઈનનુ પાલન કરવા અને કોવીડ-૧૯ બાબતે જરૂરી તકેદારી રાખવા સમજ કરેલ.

જે આપશ્રીને વિદિત થાય.

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર eGujcop

પોરબંદર